

જાતન અને તક લક્ષી આયોજન



સારસંભાળનં એક આયોજન

જેમ જેમ અર્થતંત્ર બદલાતં જાય છે, તેમ તેમ ઘણા લોકો જાત જાતના દબાણોનો સામનો કરી રહ્યા છે, જે પોતાની અને પોતાના પરિવારોની કાળજી લેવાનં વધારે ને વધારે મશ્કેલ બનાવતા જાય છે. આ પડકારો હલ કરવામાં મદદ આપવા સંભાળ અને સેવાઓ, જેના પર સમગ્ર પ્રાંતના લોકો ભરોસો રાખે છે તેમાં સરકાર વધ મૂડીરોકાણ કરી રહી છે, આમ પરિવારો જેનો સામનો કરી રહ્યા છે તે દબાણો હળવા કરી, તેમને પોતાના પ્રિયજનોની સેવા કરવાની અને આગળ વધવાની દરેક તક આપી રહી છે.



વધ બાળ સંભાળ,
વધ પસંદગીઓ

કિન્ડરગાર્ટનમાં જવાલાયક થાય ત્યાં સધી અઢી વર્ષના બાળકો માટે શાળાપૂર્વ બાળસંભાળ મફત કરીને પરિવારોને વધ પરવડી શકે તેવી ગણવત્તાયક્ત બાળસેવા પૂરી પાડી રહં છે, જે એક બાળકવાળા કટંબને 17,000 ડોલરની, સરાસરી, બચત કરાવી પરિવારોને પૂર્ણ દિવસના કિન્ડરગાર્ટનથી પણ મળતી બચતમાં વૃદ્ધિ કરે છે.



દવાઓ અને દંતસારવારનો
ખર્ચ ઘટાડવા

જેઓને કાર્યસ્થળે સ્વાસ્થ્યલક્ષી લાભો મળતા નથી અથવા જેઓને OHAIP+ કે અન્ય સરકારી કાર્યક્રમો દ્વારા આવરવામાં આવ્યા ન હોય તેમને માટે એક નવો ઓન્ટેરિઓ ડ્રગ એન્ડ ડેન્ડલ પ્રોગ્રામ દાખલ કરી રહં છે, જેમાં હકયોગ્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને દાંતની સારસંભાળના ખર્ચ પર દર વર્ષે 80 ટકા જેટલં, એકદોકલ વ્યક્તિ દીઠ 400 ડોલર, દંપતિ દીઠ 600 ડોલર અને બે બાળકો વાળા ચાર જણાના પરિવાર માટે 700 ડોલર સધી મહત્તમ વળતર આપી રહં છે.



65+ માટે નિશલ્ક પ્રિસ્ક્રિપ્શન
દવાઓ

કોઈ વરિષ્ઠ નાગરિકને ક્યારેય જરૂરી દવાઓ વગર સહન કરવં ન પડે તે સનિશ્ચિત કરવા, 65 વર્ષ અને તેનાથી ઉપરના દરેક માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ બિલકલ મફત કરી રહં છે. ઓન્ટેરિઓ ડ્રગ બેનિફિટની વાર્ષિક કપાતપાત્ર આવક અને સહ-ચકવણી નિર્મૂળ કરી, તે ઓન્ટેરિઓના સરેરાશ વડીલ દીઠ દર વર્ષે 240 ડોલરની બચત કરે છે.

જ્યારે પરિવારો જોઈતી સેવાની જરૂર હોય ત્યારે અમે તે મેળવવામાં કેવી રીતે મદદ કરી રહ્યાં છીએ

ઓન્ટેરિઓ રાજ્ય:

- કિન્ડરગાર્ટનમાં જવાલાયક થાય ત્યાં સધી અઢી વર્ષના બાળકો માટે શાળાપૂર્વ બાળસંભાળ મફત કરીને પરિવારોને વધ પરવડી શકે તેવી ગણવત્તાયક્ત બાળસેવા પૂરી પાડી રહ્યાં છે. એક બાળકવાળા કટબને એ 17,000 ડોલરની, સરાસરી, બચત કરાવી પરિવારોને પૂર્ણ દિવસના કિન્ડરગાર્ટનથી પણ મળતી બચતમાં વૃદ્ધિ કરે છે.
- જેઓને કાર્યસ્થળે સ્વાસ્થ્યલક્ષી લાભો મળતા નથી અથવા જેઓને OHIP+ કે અન્ય સરકારી કાર્યક્રમો દ્વારા આવરવામાં આવ્યા ન હોય તેમને માટે એક નવો ઓન્ટેરિઓ ડ્રગ એન્ડ ડેન્ટલ પ્રોગ્રામ દાખલ કરી રહ્યાં છે, જેમાં હકયોગ્ય પ્રિસ્ક્રિપ્શન દવાઓ અને દાંતની સારસંભાળના ખર્ચ પર દર વર્ષે 80 ટકા જેટલાં, એકદોકલ વ્યક્તિ દીઠ 400 ડોલર, દંપતિ દીઠ 600 ડોલર અને બે બાળકો વાળા ચાર જણાના પરિવાર માટે 700 ડોલર સધી મહત્તમ વળતર આપી રહ્યાં છે.
- નવો સિનિયર્સ હેલ્ધી હોમ પ્રોગ્રામ દાખલ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ વૃદ્ધો જ્યાં રહેવા માંગતા હોય ત્યાં, ઘરમાં રહેતા વરિષ્ઠો સાથે સંકળાયેલા ખર્ચાઓને માન્યતા આપે છે. તેમને સ્વતંત્ર રીતે રહેવામાં મદદ કરવા અને તેમના ઘરોને જાળવવાના ખર્ચને સરભર કરવા 75 કે તેથી વધ વયના વરિષ્ઠોની અગ્રીમતા હેઠળના પાત્રતા ધરાવતા પરિવારો માટે આ કાર્યક્રમ દર વર્ષે 750 ડોલરનો લાભ આપે છે.
- આગામી ચાર વર્ષો દરમિયાન કલ 17 બિલિયન ડોલરથી વધનું ભંડોળ ફાળવીને - સમગ્ર ઓન્ટેરિઓમાં હજારો વધ બાળકો, યવાનો અને પખ્ત વયના લોકો સધી વધ સારી અને ઝડપી માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમક્તિ માટેની સેવાઓ પહોંચાડી રહ્યાં છે.
- લોગ-ટર્મ કેર હોમમાં દરેક વ્યક્તિ જે ટૅનિક સેવા મેળવે છે તેનું પ્રમાણ સરેરાશ ચાર કલાક સધી વધારી રહ્યાં છે.
- જે લોકો હવે વધારે લાંબો સમય સ્વતંત્રપણે રહી શકે તેમ ન હોય તેમને મદદ કરવા માટે આગામી 10 વર્ષો દરમિયાન-2022 સધીમાં 5,000 નવી પથારીઓ ઉમેરીને-બીજી 30,000 નવી પથારીઓની સગવડ ઉભી કરી રહ્યાં છે અને જેઓ તેમની સંભાળ રાખે છે તેમને મનની શાંતિ પ્રદાન કરી રહ્યાં છે. આ નવી પથારીઓની સંખ્યા હાલની 30,000 પથારીઓ જે પનર્વિકસિત કરાઈ રહી છે તેમાં ઉમેરો કરે છે.
- તેઓ ક્યાં રહે તે ધ્યાનમાં લીધા વગર, ડિમેન્શિયા (ચિત્તભ્રમ) ના નવા નિદાન કરાયેલા 14,000 લોકો માટેની સેવા સધારી રહ્યાં છે.

- અગામી 10 વર્ષો દરમ્યાન હોસ્પિટલોના બાંધકામ અને જીર્ણોદ્ધાર પાછળ આશરે 19 બિલિયન ડોલરનું મૂડીરોકાણ ફાળવી રહ્યું છે, જેમાં SickKids માટે નવા પેશન્ટ કેર સેન્ટરની ડિઝાઇન અને નિર્માણના 2.4 બિલિયન ડોલર સહી, અને ઓટાવા હોસ્પિટલના સિવિક કેમ્પસના પનવિકાસ માટે ડિઝાઇન અને બાંધકામના 1.8 અબજ ડોલર સહી નો સમાવેશ થાય છે.
- 2018-19માં ઓન્ટેરિઓની હોસ્પિટલોમાં વધારાના 822-મિલિયન ડોલરના મૂડીરોકાણ - જે છેલ્લા લગભગ એક દાયકામાં મોટામાં મોટું એકમાત્ર સરકારી મૂડીરોકાણ છે - તેના દ્વારા પ્રતીક્ષાગાળા ઘટાડી રહ્યું છે, ક્ષમતાની સમસ્યાઓ હાથ ધરી રહ્યું છે અને ઓન્ટેરિઓની વધતી જતી અને વૃદ્ધ વસતીની જરૂરિયાતો સારી રીતે પૂરી કરી રહ્યું છે.
- એક અભિગમ કે જેના વડે જ્ઞાત વિકલ્પો સહીત સમાજમાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવવા 47,000 જેટલા વિકસીતાવસ્થામાં અસમર્થ વ્યક્તિઓની સેવાઓ દૃઢ કરવા 1.8 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી એક ન્યાયી સમાજનું નિર્માણ કરી રહ્યું છે.
- જરૂરિયાતવાળા લોકોને વધ સારી સહાય આપવાના હેતુસર સહાયના દરો વધારવા, જટિલ નિયમો ઘટાડવા અને માળખાને સવ્યવસ્થિત કરવા અગામી ત્રણ વર્ષો દરમ્યાન વધારાના 2.3 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરી સામાજિક સહાય (સોશ્યલ આસીસ્ટન્સ) મેળવનારા લોકોને મદદ કરી રહ્યું છે.